



પોલીસ કમિશનરની કચેરી, સુરત શહેર.  
પોલીસ ભવન, અઠવાલાઇનસ, સુરત શહેર-૩૯૫૦૦૧  
વિશેષ શાખા, કચેરી ટેલીફોન-૦૨૬૧ ૨૨૪૧૧૧૦  
કંટ્રોલ રૂમ ફેક્સ નં. ૦૨૬૧ ૨૨૪૧૩૦૪  
e-mail : special.cp.sur@gmail.com



**-:: ફોજદારી કાર્યરીતી અધિનીયમ-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ તથા**

**જી.પી.એક્ટ કલમ- ૩૭ (૪) અન્વયે કરેલ હુકમ ::-**

**ક્રમાંક:એસ.બી./ગણેશ મહોત્સવ /૧૬૩/૨૦૨૧**

**વંચાણે લીધા**

**(૧) ગ્રુહવિભાગ સચિવાલય ગાંધીનગર ક્રમાંક:વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- A તા.૨૬/૦૮/૨૦૨૧**

નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ બહાર પાડવામાં આવેલ છે. આગામી તહેવારોને અનુલક્ષીને પુખ્ત વિચારણા બાદ રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબ નીચે મુજબની માર્ગદર્શિકા અમલમાં મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

સુરત શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવ તથા જન્માષ્ટમી નો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધુમ પૂર્વક મનાવવામાં આવે છે. સુરત શહેરમાં આ વર્ષે તા.૩૦/૦૮/૨૦૨૧ ના જન્માષ્ટમી નો તહેવાર ઉજવવામાં આવનાર છે. તથા આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.૧૦/૦૮/૨૦૨૧ ના રોજ ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થનાર છે જ્યારે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન, સરઘસ અને શોભાયાત્રા સાથે તા.૧૯/૦૮/૨૦૨૧ ના રોજ નીકળનાર છે. સ્થાપના થયા તારીખથી વિસર્જનની તારીખના દિવસો દરમિયાન ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે. આ મહોત્સવ અગાઉ મૂર્તિકારો દ્વારા બનાવવામાં આવતી મૂર્તિઓના કદ બાબતે ઊંચાઇનું યોગ્ય અને નિયત ધોરણ જાળવી રાખવામાં આવે જેથી વિસર્જન પ્રક્રિયા સરળતાથી થાય અને વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક સરળતાથી ચાલુ રહે અને કાયદો-વ્યવસ્થાનાં પ્રશ્નો ઉપસ્થિત ન થાય. તેમજ મૂર્તિ બનાવવાના સ્થળે ગંદકી કરવાના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે તેમજ મૂર્તિની બનાવટમાં બીજા ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાની રાખવામાં ના આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. ઉપરાંત મૂર્તિ બનાવવા માટે કેમિકલયુક્ત રંગોના ઉપયોગ થતો હોય આવી મૂર્તિઓને નદી તથા તળાવના પાણીમાં વિસર્જન કરવાથી પાણીમાં રહેતાં પાણીજન્ય જીવો, માછલી તેમજ મનુષ્યને પણ નુકશાન થાય છે. જેથી પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદૂષણને અટકાવવા કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઇડલાઇન મુજબ તેમજ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ વખતો-વખતના ઠરાવો અને નામદાર સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મૂર્તિઓના વિસર્જન અંગે આપવામાં આવેલ ગાઇડલાઇનને ધ્યાને રાખવી જરૂરી છે.

બાબતોને ધ્યાને રાખી સુરત શહેરની જનતાની શાંતિ અને સલામતી જાળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાઇ રહે તે હેતુથી સાવચેતીના પગલા રૂપે નીચે મુજબના કૃત્યો ઉપર પ્રતિબંધ ફરમાવવાનું જરૂરી જણાય છે.

પર્યાવરણ (એન્વાયરમેન્ટ પ્રોટેક્શન) એક્ટ-૧૯૮૬ની કલમ-૫ મુજબ ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગના પત્રનં. ઇએનવી/૧૦/૨૦૧૦/૧૦૦૪/ઇ, તા.૨૬/૦૭/૨૦૧૦ ની સુચના અનુસાર નામદાર ગુજરાત હાઇકોર્ટ તથા મહારાષ્ટ્ર હાઇકોર્ટ ની સુચના તથા આપેલ આદેશ અનુસાર પર્યાવરણને નુકસાન ન થાય તે હેતુ માટે સાવચેતીના પગલા લેવા જરૂરી જણાય છે.

હું અજયકુમાર તોમર (આઇ.પી.એસ.) પોલીસ કમિશ્નર, સુરત શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગ ના તા.૦૮/૧૧/૧૯૮૨ના નોટીફિકેશન નંબર:-જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા. ૦૭/૦૧/૧૯૮૯ના સંકલીત જાહેરનામા નંબર:-જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની નીચે મુજબનો હુકમ કરું છું.

**-:વિસ્તાર:-**

સુરત શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર.

**-:હુકમ :-**

**કૃષ્ણ જન્મોત્સવ**

**અમલવારી તારીખ અને સમય:-**

તા.૩૦/૦૮/૨૦૨૧ ના ૬.૦૦/૦૦ થી તા.૩૧/૦૮/૨૦૨૧ ના ૬.૦૧/૦૦ સુધી અમલમાં રહેશે.

- તા.૩૦/૦૮/૨૦૨૧ ના રોજ કૃષ્ણ જન્માષ્ટમીના રોજ રાત્રિના કલાક ૧૨.૦૦ કલાકે પરંપરાગત રીતે યોજાતાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્ટેન્સીંગ તથા માસ્ક ફરજિયાત રહેશે.
- મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સોશીયલ ડીસ્ટેન્સીંગ સાથે દર્શન કરી શકશે.
- મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશીયલ ડીસ્ટેન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે. તથા ગોળ કુંડાળા (સર્કલ) કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે.
- આ તહેવાર સંદર્ભે મહત્તમ ૨૦૦ વ્યક્તિઓ સાથે મર્યાદિત રૂટ પર પાંરપારિક રીતે નિકળતી શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકાશે.
- આ ઉપરાંત ગૃહ વિભાગના તા.૦૭/૦૬/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦ / ૪૮૨ થી જાહેર કરવામાં આવેલ કોરોના સંક્રમણ નિયંત્રણ અંગે ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકાનું ચુસ્તપણ પાલન કરવાનું રહેશે.
- આ તહેવાર સંદર્ભે મટકી ફોડ ના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહીં.
- જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે જાહેર જનતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકે તે હેતુથી તા.૩૧/૦૮/૨૦૨૧ દિવસે સુરત શહેરમાં રાત્રિ ૬ કાર્યુ રાત્રિના ૦૧.૦૦ વાગ્યાથી લાગુ થશે.

**ગણેશ મહોત્સવ**

**અમલવારી તારીખ અને સમય:-**

તા.૦૯/૦૯/૨૦૨૧ ના ૬.૦૦/૦૦ થી તા.૧૯/૦૯/૨૦૨૧ ના ૬.૨૪/૦૦ સુધી અમલમાં રહેશે.

૧. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની જ્યારે ઘરમાં મહત્તમ ૨ ફૂટની ગણેશ મુર્તિનું સ્થાપના કરી શકાશે.
૨. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં પંડાલ /મંડપ શક્ય તેટલો નાનો રાખવાનો રહેશે.
૩. આયોજકો દ્વારા પંડાલ /મંડપમાં સોશીયલ ડીસ્ટેન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શન કરવાની વ્યવસ્થા કરવાની રહેશે.
૪. સાર્વજનિક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પુજા, આરતી, અને પ્રસાદ વિતરણ કરી શકાશે. અન્ય કોઈ ધાર્મિક/સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાના રહેશે નહીં.
૫. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧૫ વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફતે

સ્થાપન અને વિસર્જન કરી શકાશે.

૬. ઘર પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે.
૭. સ્થાનિક સત્તા મંડળ દ્વારા બનાવવામાં આવેલ નજીકના કુત્રિમ વિસર્જન કુંડમાં મુર્તિઓનું વિસર્જન કરવાનું રહેશે.
૮. સ્થાનિક સત્તા મંડળે ગણેશ વિસર્જન માટે શક્ય તેટલા વધારે કુત્રિમ વિસર્જન કુંડ બનાવવાના રહેશે. જેથી કોઈ એક જ સ્થળે વધારે ભીડ એકત્રિત ન થાય.
૯. ગણેશ મહોત્સવ તહેવાર સંદર્ભે તા. ૦૯/૦૯/૨૦૨૧ તા. ૧૯/૦૯/૨૦૨૧ દરમિયાન સુરત શહેરમાં રાત્રી કફયુ રાત્રીના ૧૨/૦૦ વાગ્યાથી લાગુ થશે. જ્યારે ગણેશ મંડપ/ પંડાલમાં રાત્રીના ૩.૧૧/૦૦ સુધી જ દર્શન ચાલુ રાખી શકાશે.
- તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

અધિક મુખ્ય સચિવશ્રી વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓનો પત્ર નં. ઇએનવી/૧૦/૨૦૧૦/૧૦૦૪/ઇ તા. ૨૬/૦૭/૨૦૧૦ દ્વારા પાઠવેલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સરકારશ્રી ના વન અને પર્યાવરણ વિભાગ) તરફથી દરીયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે આપેલ સુચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના તા. ૦૯/૦૫/૨૦૧૩ના હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ, સેન્ટ્રલ ઝોન બેન્ચ, ભોપાલના તા. ૧૮/૦૮/૨૦૧૫ના હુકમને આધારે ઉપર મુજબના પ્રતિબંધો સુરત શહેરમાં બહારથી ગણેશજીની મૂર્તિઓ લાવી વેચતા મૂર્તિકારો અને વેપારીઓને પણ લાગુ પડશે. જે અંગે પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

#### -:શિક્ષા:-

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર THE EPIDEMIC DISEASES ACT 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઈઓ, ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, જી.પી.એક્ટ ૧૩૫ તથા, The Disaster Management Act, ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

#### -:જાહેર વિજ્ઞાપન:-

હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત ઉપર જણાવેલ વિસ્તારોમાં સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલ ચોંટાડી, લાઉડ સ્પીકર વાહન દ્વારા તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રો ઉપરથી પ્રસિધ્ધ કરાવવું.

આ હુકમ અન્વયે સુરત કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ફોજદારી અધિનિયમ સને-૧૯૬૦ ની કલમ ૧૮૮, જી.પી.એક્ટ ૧૩૫, THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 અને લાગુ અન્ય કાનૂની જોગવાઈઓ સહિત, The Disaster Management Act, 2005 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

આજ તા. ૨૭/૦૮/૨૦૨૧ ના રોજ મારી સહી અને સિક્કા કરી આપેલ છે.



(અજયકુમાર તોમર)  
પોલીસ કમિશ્નર,  
સુરત શહેર.

પ્રતિ,

- (૧) અધિક પોલીસ કમિશ્નરશ્રી, સેક્ટર-૧, રતથા ટ્રાફિક એન્ડ ક્રાઇમ સુરત શહેર.
- (૨) . નાયબ પોલીસ કમિશ્નરશ્રી, તમામ, સુરત શહેર
- (૩). મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, તમામ સુરત શહેર
- (૪). તમામ પો.સ્ટે./ શાખા ઈન્ચાર્જશ્રીઓ, સુરત શહેર.(નકલો ચોંટાડી લાઉડ સ્પીકર, વાહન ધ્વારા જાહેરાત કરાવવા સારૂ)
- (૫) કંટ્રોલ ઈન્ચાર્જશ્રી, સુરત શહેર (તમામ વર્તમાનપત્રો તથા ન્યુઝ ચેનલોને એક-એક નકલ આપવી).

સવિનય નકલ રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) પોલીસ મહાનિદેશકશ્રી અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગુ.રા., ગાંધીનગર.
- (૩) અધિક પોલીસ મહાનિદેશકશ્રી (ઈન્ટે.), ગુ.રા., ગાંધીનગર.
- (૪) પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર, રાજકોટ શહેર/વડોદરા શહેર.
- (૫) પોલીસ મહાનિરીક્ષકશ્રી સુરત રેન્જ, સુરત.
- (૬) કલેક્ટરશ્રી, સુરત શહેર.
- (૭) મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, સુરત શહેર
- (૮) નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, (ઈન્ટે.) સુરત રીજીયન, સુરત
- (૯) પોલીસ અધિક્ષકશ્રી, સુરત રૂરલ.
- (૧૦) નિયામકશ્રી, માહિતી ખાતુ, ગુ.રા., ગાંધીનગર.
- (૧૧) જીલ્લા સરકારી વકીલશ્રી, સેસન્સ કોર્ટ, સુરત.
- (૧૨) મેનેજરશ્રી, ગર્વનમેન્ટ પ્રેસ વડોદરા, (ગેઝેટ ભાગ-૧ માં પ્રસિધ્ધ કરવા સારૂ).
- (૧૩) પો.ઈન્સ.શ્રી, સુરત રેલ્વે પો.સ્ટે.
- (૧૪) રજીસ્ટ્રારશ્રી, હાઈકોર્ટ, ગુ.રા., સોલા રોડ, અમદાવાદ.
- (૧૫) રજીસ્ટ્રારશ્રી, ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, સુરત .
- (૧૬) રજીસ્ટ્રારશ્રી, ચીફ જ્યુડીશ્યલ મેજી.શ્રી કોર્ટ, સુરત.
- (૧૭) વધારાના એકઝીક્યુટીવ મેજી.શ્રી, સુરત શહેર.( નાનપુરા બહુમાળી સુરત )
- (૧૮) સબ ડીવીઝનલ મેજી.શ્રી, સીટી પ્રાંત. ( જીલ્લા સેવા સદન અઠવાલાઇન્સ સુરત
- (૧૯) સંયુક્ત માહિતી નિયામકશ્રી, સુરત ( સ્થાનિક વર્તમાનપત્રો, આકાશવાણી તથા દુરદર્શન કેન્દ્રમાં પ્રસિધ્ધ કરવા સારૂ.)